

Corporate Office :
406, Silver Oaks Comm. Complex,
Opp. Arun Society, Paldi,
Ahmedabad-380 007. Gujarat, India.
Phone : 079-26584655
Fax : 079-26588054
CIN No. : L24231GJ2004PLC043861
E-mail : info@sakarhealthcare.com
Web : www.sakarhealthcare.com

22nd November, 2023

**Listing Department,
National Stock Exchange Limited**
Exchange Plaza, C-1 Block-G
BandraKurla Complex,
Bandra (E), Mumbai – 400 051

Symbol: SAKAR

ISIN: INE732S01012

Dear Sir,

Sub: Submission of Newspaper clippings – Advertisement

We are enclosing herewith clippings of Newspapers Advertisement addressed to the Shareholders, published on 22nd November, 2023 for your information and records.

This is in due compliance of the relevant Regulations of the SEBI (LODR) Regulations, 2015.

Thanking you,

Yours faithfully,
for SAKAR HEALTHCARE LIMITED

BHARATKUMAR
SUKHLAL SONI

Digitally signed by
BHARATKUMAR SUKHLAL SONI
Date: 2023.11.22 12:12:14 +05'30'

**BHARAT SONI
COMPANY SECRETARY &
COMPLIANCE OFFICER**

Encl: As above.

Microsoft Outlook Lite Expands its Reach with Vernacular features and SMS support for Indian Users

New Delhi, Microsoft has announced new vernacular features in Outlook Lite, an email and SMS app designed specifically for Indian users that combines the best of email, and SMS in one place.

Outlook Lite brings all the important features of Microsoft Outlook in a smaller-sized app with fast performance for lightweight devices on any network. Along with being a smaller sized app, one of the main focus areas for Outlook Lite is to solve for the needs of emerging market users. In regard to the same, Outlook Lite now supports two core scenarios, support for Indian vernacular languages and support for SMS, to enable Indian users to effectively communicate.

Outlook Lite is inclusive and responsive to the diverse linguistic needs of Indian users with features

such as voice typing, transliteration, and reading emails in regional languages, to make it easier for users to compose and read emails in their preferred language. Whether users want to dictate an email in Hindi, type an email in Tamil, and have it automatically converted to English, or read an email in Gujarati, Outlook Lite helps them do just that. Currently supporting five Indian languages, including Hindi, Tamil, Telugu, Marathi, Gujarati, it will soon expand to more. More languages and dialects will also be added in future to continue catering to the linguistic diversity of India.

Outlook Lite also supports SMS messaging, simplifying how users consume transactional and promotional information, by providing a unified and smart inbox that organizes messages by category,

such as transactions, promotions and personal. Users can easily switch between different categories and view relevant messages in one place. It also reminds them of important appointments, travel bookings, bill payments, and gas booking reminders which usually get lost in information overload.

Rajiv Kumar, Managing Director, Microsoft India Development Centre and Corporate Vice President of Microsoft's Experiences and Devices, India Group said, "The evolution of Outlook Lite embodies our dedication to fostering inclusive digital experiences tailored for diverse communities in India. With SMS integration and vernacular language support, Outlook Lite redefines communication accessibility and provides users with a more convenient & personalized experience."

Flair Writing Industries IPO to Opens today: Price band Rs. 288 to Rs. 304

Ahmedabad, Flair Writing Industries Limited (the "Company"), shall open its initial public offering of Equity Shares on Wednesday, November 22, 2023.

The Company plans to raise funds through Equity Shares of face value Rs. 5 each aggregating up to Rs. 5,930.00 million [Rs. 593 crore]. The offer comprises of fresh issue of Equity Shares aggregating up to Rs. 2,920.00 million [Rs. 292 crore] ("Fresh Issue") and an offer for sale aggregating up to Rs. 3,010.00 million [Rs. 301 crore] (the "Offer for Sale") and together with the Fresh Issue, the "Offer"). The Company, in consultation with the Book Running Lead Managers, has undertaken a Pre-IPO Placement of 2,401,315 Equity Shares at an issue price of Rs.



304.00 per Equity Share (including a premium of Rs. 299.00 per Equity Share) for a cash consideration aggregating to Rs. 730.00 million [Rs. 73 crore], on November 10, 2023.

The Company proposes to utilize net proceeds from the fresh issue towards (a) Setting up a new manufacturing facility for writing instruments in District Valsad, Gujarat - estimated amount is Rs. 559.93 million [Rs. 55.99 crore], (b) Funding capital expenditure of the Company and Flair Writing Equipments Private Limited ("FWEPL"), one of

its Subsidiaries - estimated amount Rs. 867.48 millions [Rs. 86.75 crore], (c) Funding working capital requirements of the Company and its Subsidiaries, FWEPL and Flair Ceyl Industries Private Limited ("FCIPL") - estimated amount Rs. 770.00 million [Rs. 77.00 crore], (d) Repayment/pre-payment, in part or full, of certain borrowings availed by the Company and its Subsidiaries, FWEPL and FCIPL - estimated up to Rs. 430.00 million [Rs. 43 crore], and balance amount will be utilized towards general corporate purpose.

Rupee fails to recover despite fall in US dollar

Mumbai, Nov 21 (IANS) The rupee failed to recover in morning trade on Tuesday despite a weak dollar and was hovering at the previous day's record low of 83.34 against the US greenback at 11.28 a.m. Although the dollar index fell to 103.20, its lowest level in two-and-a-half months, the rupee did not gain as expected. Traders attributed this to importers such as oil companies buying more dollars as a hedge to take advantage of the low price. Other Asian currencies have gained due to the decline in the US dollar. The rupee had crashed by 7 paise to settle at 83.34 vis-a-vis the US dollar on Monday, amid an increase in crude oil prices and foreign funds flowing out of stock markets. Brent crude futures, the global oil benchmark, rose 0.66 per cent to USD 81.14 per barrel on Monday while the Sensex declined 139.58 points to settle the 65,655.15 level. The Nifty fell 37.80 points to 19,694. Foreign institutional investors (FIIs) were net sellers in the capital markets on Friday as they sold shares worth Rs 477.76 crore, according to exchange data. India's foreign exchange reserves decreased by USD 462 million to USD 590.321 billion for the week ended November 10, according to the latest RBI data released on Friday.

Tata Motors and Inchcape plc usher in a new era of commercial vehicle excellence in Thailand

Bangkok, Tata Motors, one of the world's leading automobile manufacturers, is reaffirming its dedication to delivering class-leading commercial vehicles to the Thai market. The company, along with its authorised distributor Inchcape - a leading global automotive distributor, announced it has commenced the sales and service of its commercial vehicles across Thailand. This endeavour marks Tata Motors' commitment to revolutionising the landscape of commercial transportation in Thailand. The company also launched an impressive line-up of new-age trucks, including Tata Super Ace,

Tata Ultra T.9, Tata Ultra T.14 and the flagship Tata Prima 5038.S, with a gamut of value-added services, such as Tata Protect and Tata OK.

In April 2023, Tata Motors announced a strategic partnership with Inchcape plc - as its distributor for commercial vehicles in Thailand. To ensure that customers have easy access to support and services across Thailand, Inchcape plc will also establish an extensive network of 13 customer touchpoints including sales, service and spare parts, strategically located to provide seamless assistance to its customers.

Commenting on the

launch, Mr. Anurag Mehrotra, Head, International Business, Tata Motors Commercial Vehicles, said "We are delighted to commence our operations in Thailand. Tata Motors has been one of the leading manufacturers of commercial vehicles that offers functionality, productivity, connectivity, safety and performance. With deep experience in catering to commercial vehicle customers across the globe, our products are engineered to offer the highest profitability and reliability to the fleet owners. These solutions are not mere commercial vehicles, but a testament to our dedication to safety and innovation. Our unwavering commitment to customer centricity is at the heart of everything we do. Jointly with Inchcape, we are confident of delivering a complete peace of mind to our customers with our strategically located sales and service touchpoints in Thailand. With Inchcape's global leadership in vehicle retail, we are poised to set new standards and

drive progress in the Thai transportation industry."

Expressing their enthusiasm at the announcement, Mr. Charnchai Mahantakun, Managing Director of Inchcape (Thailand) Company Limited, said, "With the cooperation of Tata Motors and Inchcape Thailand, we are confident of creating value for the transportation industry and the Thai commercial truck market. Tata Motors has a worldwide reputation for reliability, wide vehicle portfolio, high quality of vehicles that are designed to meet all types of usage needs; from short distance transport using small trucks to long-distance transportation using large trucks.

At the outset, Inchcape will offer the Tata Super Ace, Tata Ultra T.9, Tata Ultra T.14 and the flagship Tata Prima 5038.S to address the varied requirements in the industry. These vehicles are perfectly suited for Thailand and will offer the best-in-segment performance, fuel efficiency, reliability and comfort.

Salesforce CEO offers jobs to any OpenAI researcher who has quit

New Delhi, Nov 21 (IANS) Enterprise software major Salesforce's Chair and CEO Marc Benioff on Tuesday offered jobs to any OpenAI researcher who has tendered resignation and their immigration is impacted, as more than 500 OpenAI staffers threaten to quit after Microsoft hired former CEO Sam Altman and ex-president Greg

Brockman.

In a post on X, Benioff said if your immigration is now impacted by OpenAI on O1, H1B, or other visa, then Salesforce will match "full cash and equity OTE (open trade equity)" of those who quit OpenAI "to immediately join our Salesforce Einstein Trusted AI research team under Silvio Savarese".

"Send me your cv directly to ceo@salesforce.com. Einstein is the most successful enterprise AI Platform

completing 1 trillion predictive generative transactions this week! Join our Trusted AI Enterprise Revolution," the Salesforce CEO wrote. Salesforce this year committed \$500 million to invest in generative artificial intelligence (AI) startups. The investment, an expansion from earlier \$250 million to \$500 million now, is part of its Generative AI Fund to support startups developing "responsible generative AI". According to Salesforce Ventures managing partner Paul Drews, it will help the company to

"work with even more entrepreneurs, accelerating the development of transformative AI solutions for the enterprise".

CHANGE OF NAME

I have changed my old name from **SHAIKH ALTAF HUSEN RIYAZAHMED** to **HASHMI ALTAHUSEN RIYAZAHMED**
Add. 175, Ahemadhusen Ni Chali, Dudheshvar VTC Ahmedabad-380004 4058

CHANGE OF NAME

I have changed my old name from **RAKSHABEN GAUTAMKUMAR JANI** to **RAKSHABEN GAUTAMBHAI JANI**
Add. S-5-56, Shanti Apartment, Shastrinagar, Naranpura, Ahmedabad-380013 4060

E AUCTION NOTICE FLOOD AFFECTED APPROX. 2,60,057 KG OF FERTILIZERS.

Interested Buyers are invited to participate in the e-Auction for the disposal of "Flood Affected Approx. 2,60,057 Kg of Fertilizers" on "Per Kg" Basis. The subject salvage will be sold on "As is Where is", Whatever there is" and "No Complaint" Basis and belongs to M/s. Gujarat Agro Industries Corporation Ltd. The subject materials can be inspected at A-1, Jagdish Oil Mill Compound, Reliance Petrol Pump Backside, Rajkot Highway, Junagadh, Gujarat, between 22-11-23 to 25-11-23 between 11 AM to 4.30 PM only. Kindly contact Mr. R B Kanani at 8200585458 for inspection.

E-AUCTION WILL BE HELD ON 28-11-23.

Kindly contact Mr. Atul Halarnkar at 7738164069 to obtain the form containing terms & conditions of e-Auction or download from website <https://www.sealthdeal.co.in/>.

Auctioneers: Seal The Deal having registered office at 148, Pocket C2, Sector 5, Rohini, Delhi - 110085.

LAST DATE OF SUBMISSION OF FORM & EMD DEMAND DRAFTY IS 25-11-23.

GUJARAT MARITIME BOARD Short Tender Notice No.24 of 2023-24

On Behalf of the Chairman, Gujarat Maritime Board, Executive Engineer (Mech.) Bedi port, Jamnagar invites on-line tenders for below mentioned works.

Name of the works	Request for proposal for Providing 02 Nos. passenger boat/ferry of minimum 06 passenger capacity, 01 No. passenger boat/ferry of minimum 12 passenger capacity and 01 No. passenger boat/ferry of minimum 20 passenger capacity at Lukki Nala, Kutch on charter-hire basis. (Second Attempt)
-------------------	----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Schedule of e-tendering	
Last date of Uploading till	28/11/2023 up to 18:00 hrs.

All other details as per tender document. Bidder can view, download & submit their bid through www.tender.nprocure.com, only. Tender documents will also available on GMB web site: www.gmbports.org

મહત્વિત-ગમ./વ.ગમ./૧૪૦૬/૨૦૨૩

SAKAR HEALTHCARE LIMITED

[CIN: L24231GJ2004PLC043861]

Registered Office: Block No. 10-13, Sarkhej-Bavla Road, Village: Changodar, Dist: Ahmedabad - 382 213

NOTICE TO THE SHAREHOLDERS FOR EXTRA ORDINARY GENERAL MEETING

NOTICE is hereby given that the Extra Ordinary General Meeting (EGM) of the Company will be held on Wednesday, the 20th December, 2023 at 12.00 Noon through Video Conference ("VC")/Other Audio-Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of EGM, which is being circulated for convening the EGM.

Ministry of Corporate Affairs, vide its General Circular No. 09/2023 dated 25.09.2023, 11/2022 dated 28.12.2022, General Circular No. 3/2022 dated 05.05.2022 and General Circular No. 14/2020 dated 08.04.2020 and SEBI Circulars, have permitted the holding of EGM through VC/OAVM, without the physical presence of the Members at a common venue. In compliance with these Circulars and the relevant provisions of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the EGM of the Members of the Company will be held through VC/OAVM.

In accordance with the aforesaid Circulars, Notice of the EGM along with the Explanatory Statement is being sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Members may note that the Notice of EGM and Explanatory Statement will also be available on the Company's website - www.sakarhealthcare.com, website of the Stock Exchange i.e. NSE Limited at www.nseindia.com and the EGM Notice is also available on the website of CDSL (agency for providing the Remote e-voting facility) i.e. www.evotingindia.com. Members can attend and participate in the EGM through the VC/OAVM facility only. The instructions for joining the EGM are provided in the notice of EGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies Act, 2013.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of EGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the EGM ("e-voting").

Detailed procedure for remote e-voting/e-voting facility is provided in the Notice of EGM.

In case Member(s) have not registered their e-mail addresses with the Company/Depository, please follow the below instructions to register e-mail address for obtaining Notice and login details for e-voting.

a. For members holding shares in Physical mode - please provide necessary details like Folio No., scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to our RTA, Link Intime India Private Limited on their Email id: ahmedabad@linkintime.co.in ; rnt.helpdesk@linkintime.co.in

b. Members holding shares in Demat mode can get their E-mail ID registered by contracting their respective Depository Participant or by email to ahmedabad@linkintime.co.in ; rnt.helpdesk@linkintime.co.in.

The EGM Notice will be sent to the shareholders holding shares as on cut off for the dispatch in accordance with the applicable laws on their registered e-mail addresses in due course.

In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or call 1800225533.

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futrex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai- 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call 1800225533.

By Order of the Board,
for SAKAR HEALTHCARE LIMITED

BHARAT SONI
COMPANY SECRETARY & COMPLIANCE OFFICER

Place : Ahmedabad
Date : 21th November, 2023

Business Brief III

Fintech startup Kiwi raises \$13 mn led by Omidyar Network India

Bengaluru, Nov 21 (IANS) Homegrown fintech startup Kiwi on Tuesday said it has \$13 million (about Rs 108 crore) in a Series-A funding round led by Omidyar Network India.

Existing investors, Nexus Venture Partners and Stellaris Venture Partners, also participated in this round.

Founded in November 2022, Kiwi said that the funding will enable it to further expand its 'credit cards on UPI' offerings in India.

The 'credit cards with UPI' feature is enabled by issuing digital RuPay Cards in collaboration with banks. Certified by the NPCI as a licensed UPI third-party app, Kiwi had previously secured \$6 million in funding from investors including Nexus Venture Partners, Stellaris Venture Partners and others. "The funds will enable us to further develop our services and offer innovative products to our customers as we enter the next phase of product development and growth," said Anup Agrawal, co-founder and CEO of Kiwi. Kiwi is co-founded by industry veterans like Siddharth Mehra (ex-CEO, Freecharge), Mohit Bedi (ex-Axis Bank and PayU), and Agrawal (ex-business head, LazyPay).

US SEC sues crypto trading platform Kraken

Washington, Nov 21 (IANS) The US Securities and Exchange Commission (SEC) has charged crypto trading platform Kraken for operating as an unregistered securities exchange, broker, dealer and clearing agency.

According to the SEC's complaint, since at least September 2018, Kraken has made hundreds of millions of dollars unlawfully facilitating the buying and selling of crypto asset securities.

"We allege that Kraken made a business decision to reap hundreds of millions of dollars from investors rather than coming into compliance with the securities laws. That decision resulted in a business model rife with conflicts of interest that placed investors' funds at risk," said Gurbir S. Grewal, Director of the SEC's Division of Enforcement. "Kraken's choice of unlawful profits over investor protection is one we see far too often in this space, and we're holding Kraken accountable for its misconduct and sending a message to others to come into compliance," he said in a statement. The SEC alleged that Kraken intertwined the traditional services of an exchange, broker, dealer, and clearing agency without having registered any of those functions with the Commission as required by law.

Weakening Chinese growth prospects will weigh on commodities

New Delhi, Nov 21 (IANS) The range bound movement of the market is likely to be broken with an upward move soon, says V.K. Vijayakumar, Chief Investment Strategist at Geojit Financial Services. The global cues are supportive. The softening US bond yields, the 10-year yield is at 4.41 per cent, will provide the big global macro backdrop for a market rally, he said.

The market is likely to wait till the state elections outcome is known. If the election outcome indicates political stability even after the General elections of 2024, that will act as the trigger for the rally. And, if such a rally happens, it is likely to be led by large-caps across the board in sectors like banking, IT, automobiles, capital goods, telecom, real estate and construction-related segments, he said. Weakening Chinese growth prospects will weigh on commodities. Financials, particularly NBFCs, beaten down by the RBI decision to hike the risk weightage on unsecured loans present long-term buying opportunity, he added. BSE Sensex is up 277 points at 65,932 points. JSW Steel is up more than 2 per cent. Reliance is up more than 1 per cent.

BSE 500 companies revenues flat but profits zoom

New Delhi, Nov 21 (IANS) The 2QFY24 results of BSE-500 Index companies showed further weakness in revenues (0.7 per cent yoy decline ex-BFSI), even as earnings growth remained robust (47 per cent yoy). Kotak Institutional Equities said in a report. Oil, gas and consumable fuels exaggerated the operating performance in 2QFY24. Companies witnessed continued expansion in margins on both qoq and yoy basis, with aggregate EBITDA margins of non-BFSI BSE-500 universe up almost 500 bps yoy. Consensus earnings estimates for the BSE-500 universe were largely stable, despite the strong yoy earnings growth in 2QFY24. The analysis of BSE-500 companies 2QFY24 results (for which quarterly earnings data is available over 2QFY20-2QFY24) shows that revenue growth slowed further to 4.6 per cent yoy on aggregate but declined 0.7 per cent yoy ex-BFSI basis (see Exhibit 1). EBITDA of non-financial companies of this universe increased a sharp 40 per cent yoy, while PAT increased at an even sharper 56 per cent yoy (47 per cent yoy including BFSI), the report said. Both the revenue and profit trends reflect sharp deflation in raw material prices.

SEBI Chairperson unveils Investor Risk Reduction Access platform

Mumbai, Nov 20 (IANS) Chairperson of the Securities and Exchange Board of India (SEBI), Madhabi Puri Buch has launched the Investor Risk Reduction Access (IRRA) platform at the Bombay Stock Exchange (BSE).

Risk Mitigation in financial markets is an evergreen subject and constant efforts are made by regulators to address risks of various kinds.

The IRRA platform is one such initiative conceptualised and implemented by Market Infrastructure Institutions (MIs) under the guidance of SEBI to reduce risks faced by investors in the eventuality of technical glitch at Trading Member end at both Primary site and Disaster Recovery site. Mills soft launched IRRA platform with effect from October 3, 2023 and officially launched IRRA platform on Monday for the benefit of investors at large. The platform is available to the trading members supporting Internet-based trading and Security Trading through Wireless Technology for their investors. IRRA however would not be available for algo trading and Institutional clients.

IRRA can be invoked by Trading Members when they are faced with a technical glitch at their end impacting their ability to service clients across exchanges from both -- Primary site and Disaster Recovery site, where relevant.

On invocation, after basic checks, the platform downloads trades of Trading Member from all the trading venues and sends SMS/email to investors using internet trading or wireless technology along with a link to access IRRA. Investors using this link can review of status of their investment, orders etc., and place orders for squaring off or closing positions.

